

עֲרוֹתָהּ: तेनी-नअता	תְּנַלְהָ ઉઘાડજે	לֹא નહિ	הָוָא છે-તે	אִמָּךְ તારી-માતા	תְּנַלְהָ ઉઘાડજે	לֹא નહિ	אִמָּךְ તારી-માતાની	וְעֲרוֹת અને-નअता	אֲבִיךָ તારા-પિતાની	עֲרוֹת નअता	7
H6172	H1540	H3808	H1931	H0517	H1540	H3808	H0517	H6172	H0001	H6172	

ס
—

The nakedness of thy father, even the nakedness of thy mother, shalt thou not uncover: she is thy mother; thou shalt not uncover her nakedness.

עֲרוֹת નअता	אִשְׁת־ પત્નીની	אֲבִיךָ તારા-પિતાની	לֹא નહિ	תְּנַלְהָ ઉઘાડજે	עֲרוֹת નअता	אֲבִיךָ તારા-પિતાની	הָוָא: છે	ס —	8
H6172	H0802	H0001	H3808	H1540	H6172	H0001	H1931		

The nakedness of thy father's wife shalt thou not uncover; it is thy father's nakedness.

עֲרוֹת નअता	אֶחָיו તારી-બહેનની	בֵּת દીકરી	אֲבִיךָ તારા-પિતાની	או અથવા	בֵּת દીકરી	אֶחָיו તારી-માતાની	מולדת જ-મેલી	או અથવા	מולדת જ-મેલી	9
H6172	H0269	H1323	H0001		H1323	H0517	H4138		H4138	

קוץ બહાર	לֹא નહિ	תְּנַלְהָ ઉઘાડજે	עֲרוֹתָן: તેમની-નअता	ס —	9
H2351	H3808	H1540	H6172		

The nakedness of thy sister, the daughter of thy father, or the daughter of thy mother, whether born at home, or born abroad, even their nakedness thou shalt not uncover.

עֲרוֹת નअता	בֵּת દીકરીની	בְּנִי તારા-પુત્રની	או અથવા	בֵּת દીકરીની	לֹא નહિ	תְּנַלְהָ ઉઘાડજે	עֲרוֹת તેમની-નअता	כי કારણ-કે	עֲרוֹת તારી-નअता	10
H6172	H1323	H3808		H1323	H3808	H1540	H6172		H6172	

הָוָא: છે-તે	ס —	10
H2007		

The nakedness of thy son's daughter, or of thy daughter's daughter, even their nakedness thou shalt not uncover: for theirs is thine own nakedness.

עֲרוֹת નअता	בֵּת દીકરીની	אִשְׁת־ પત્નીની	אֲבִיךָ તારા-પિતાની	מולדת જ-મેલી	עֲרוֹת જ-મેલી	אֲחֹת તારી-બહેન	הָוָא છે-તે	לֹא નહિ	תְּנַלְהָ ઉઘાડજે	עֲרוֹת તેમની-નअता	כי કારણ-કે	עֲרוֹת તારી-નअता	11
H6172	H1323	H0802	H0001	H4138	H0001	H0269	H1931	H3808	H1540	H6172		H6172	

ס
—

The nakedness of thy father's wife's daughter, begotten of thy father, she is thy sister, thou shalt not uncover her nakedness.

עֲרוֹת નअता	אֲחֹת- બહેનની	אֲבִיךָ તારા-પિતાની	לֹא નહિ	תְּנַלְהָ ઉઘાડજે	שְׁאָר બોહીની-સગી	אֲבִיךָ તારા-પિતાની	הָוָא: છે	ס —	12
H6172	H0269	H0001	H3808	H1540	H7607	H0001	H1931		

Thou shalt not uncover the nakedness of thy father's sister: she is thy father's near kinswoman.

עֲרוֹת નअता	אֲחֹת- બહેનની	אִמָּךְ તારી-માતાની	לֹא નહિ	תְּנַלְהָ ઉઘાડજે	כי- કારણ-કે	שְׁאָר બોહીની-સગી	אִמָּךְ તારી-માતાની	הָוָא: છે	ס —	13
H6172	H0269	H0517	H3808	H1540		H7607	H0517	H1931		

Thou shalt not uncover the nakedness of thy mother's sister: for she is thy mother's near kinswoman.

22 וְאֵת- זָכָר לֹא תִשְׁכַּב מִשְׁכַּבֵי אִשָּׁה תוֹעֵבָה הוּא :
 અને- સાથે પુરુષ- સાથે નહિ સૂજે શય્યામાં સ્ત્રીની તોણાસ્પદ છે-તે
[H1931](#) [H8441](#) [H0802](#) [H4904](#) [H7901](#) [H3808](#) [H2145](#) [H0854](#)

Thou shalt not lie with mankind, as with womankind: it is abomination.

23 וּבְכָל- בְּהֵמָה לֹא- תִתֵּן שְׁכַבְתָּהּ לְטֹמְאָה- כָּהֵן וְאִשָּׁה לֹא- תַעֲמֹד לְפָנָי
 અને-કોઈ-પણ પ્રાણી-સાથે નહિ આપજે આપજે તારા-વીર્યને લેખ-થવા તેનાથી અને-સ્ત્રી નહિ સામે
[H6440](#) [H5975](#) [H3808](#) [H0802](#) [H7903](#) [H5414](#) [H3808](#) [H0929](#) [H3605](#)

בְּהֵמָה לְרִבְעֹתָהּ תִבֹּל הוּא :
 પ્રાણીનું સંભોગ-માટે વિકૃતિ છે
[H1931](#) [H8397](#) [H7250](#) [H0929](#)

And thou shalt not lie with any beast to defile thyself therewith; neither shall any woman stand before a beast, to lie down thereto: it is confusion.

24 אֶל- תִּטְמָאוּ בְּכָל- אֲלֹהֵי כֹי בְּכָל- אֲלֹהֵי נִטְמָאוּ הַגּוֹיִם אֲשֶׁר- אָנֹכִי
 નહિ અશુદ્ધ-કરજો અશુદ્ધ-થયા વસ્તુઓથી આ-બધી કારણ-કે વસ્તુથી આ-કોઈ-પણ અશુદ્ધ-કરજો
[H0589](#) [H0428](#) [H3605](#) [H0428](#) [H3605](#) [H0408](#)

מִשְׁלַח מַפְנִיכֶם :
 કાઢી-મુકુ-છું તમારી-આગળથી
[H6440](#) [H7971](#)

Defile not ye yourselves in any of these things: for in all these the nations are defiled which I cast out from before you;

25 וְהַטְּמָא הָאָרֶץ וְהִאֲפָקֵד אֶת- עֲוֹנֹתָ עָלֶיהָ וְהָאָרֶץ וְהַטְּמָא
 ભૂમિ અને-અશુદ્ધ-થઈ ભૂમિ અને-શિક્ષા-કરી અને-શિક્ષા-કરી ભૂમિ અને-અશુદ્ધ-થઈ
[H0853](#) [H0776](#) [H6958](#) [H5771](#) [H0776](#)

שְׂבִיחַ תֵּן-לָהּ
 તેના-રહેવાસીઓને
[H3427](#)

and the land is defiled: therefore I do visit the iniquity thereof upon it, and the land vomiteth out her inhabitants.

26 וְשִׂמְרַתֶּם אֹתָם אֶת- חֲקֹתַי וְאֵת- מִשְׁפָּטַי וְלֹא תַעֲשׂוּ מִכֹּל הַתּוֹעֵבוֹת
 અને-જાળવજો તમે — મારા-વિધાનો અને મારા-નિયમો અને-નહિ આ કરજો કોઈ-પણ કાર્યો
[H8441](#) [H3605](#) [H3808](#) [H4941](#) [H0853](#) [H2708](#) [H0853](#) [H8104](#)

הָאֲלֹהֵי הָאָרֶץ וְהָאֲזֻחַ וְהָגֵר בְּתוֹכְכֶם :
 આ-માંથી દેશી અને-પરદેશી જે-રહે-છે તમારી-વચ્ચે
[H8432](#) [H1616](#) [H0249](#) [H0428](#)

Ye therefore shall keep my statutes and mine ordinances, and shall not do any of these abominations; neither the home-born, nor the stranger that sojourneth among you

27 כִּי אֶת- כָּל- הַתּוֹעֵבוֹת הָאֵלֹהִים עָשׂוּ אֲנֹשִׁי- הָאָרֶץ אֲשֶׁר לְפָנָי
 કારણ-કે — બધા આ કર્યો લોકોએ ભૂમિના તમારી-આગળ-હતા
[H6440](#) [H0776](#) [H0376](#) [H0411](#) [H8441](#) [H3605](#) [H0853](#)

וְהַטְּמָא הָאָרֶץ :
 અને-અશુદ્ધ-થઈ ભૂમિ
[H0776](#)

(for all these abominations have the men of the land done, that were before you, and the land is defiled);

